

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ ખાતે પોષણ માહની ઉજવણી

સરકારશ્રી દ્વારા સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણ યુક્ત આહાર મળી રહે અને કુપોષિત થતાં અટકે એ માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન ચલાવવામાં આવે છે જેના અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ અને ઇફકોના સયુક્ત ઉપક્રમે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ પોષણ માહની ઉજવણીના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ જીલ્લાના વિવિધ તાલુકાની કુલ ૧૨૨ બેહેનો, ૩૩ કિશોરીઓ અને ૧૬ ભાઈઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ પશુપાલન ખાતાના પશુચિકિત્સક ડૉ. કવિતાબેન કુરૂપે હાજરી આપી હતી.

આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય પોષણ એન્થેમ દ્વારા કરવામાં આવી. કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. કે. ડી. ગુલકરીએ તેમના ઉદબોધનમાં માનવ જીવનમાં પોષણનું મહત્વ સમજાવતા પોષક અનાજ ની ખેતી વિષે માહિતી આપી હતી.

ઇફકો દ્વારા કૃષક મહિલાઓને ઘર આંગણે શાકભાજીનું વાવેતર કરી રોજિંદા ખોરાકમાં પોષ્ટિકતા વધારી શકાય તે માટે શાકભાજીના બિયારણ તેમજ વિવિધ ફળ ઝાડ જેવાકે જામફળ, સીતાફળ, લીંબુ, દાડમ વગેરેના રોપા નું વિતરણ કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઇફકો પ્રતિનિધિ શ્રી અંકિત ચૌધરી કાર્યક્રમમાં હજાર રહ્યા હતા અને બહેનોને પ્રોત્સાહિત કરી હતી.

સદર કાર્યક્રમ માં પશુપાલન ખાતાના પશુચિકિત્સક ડૉ. કવિતાબેન દ્વારા બહેનોને પોષણ અંગે વ્યાખ્યાન આપ્યું હતું તેમજ શ્રીમતી હિનાબેન (વૈજ્ઞાનિક, ગૃહવિજ્ઞાન) દ્વારા ન્યુટ્રિ સીરીયલ જેવાકે જુવાર, બાજરી, રાગી, કોદરી, સામો વગેરેના પોષણ મૂલ્યો તેમજ સ્વાસ્થ્ય માટે તેના લાભા-લાભ અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ- 2023 અંગે માહિતી આપી કૃષક બહેનોને તેના ઉત્પાદન અને દૈનિક ઉપયોગ માટે નિવેદન કર્યું હતું, સાથે તે અંગેનું પ્રદર્શન નિહાળી બહેનો પ્રોત્સાહિત થઈ હતી.

કિશોરવયની કન્યાઓ માટે મિલેટથી બનાવેલ વિશિષ્ટ નાસ્તો પણ પીરસવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભાઈઓ, બહેનો અને બાળાઓ દ્વારા રાષ્ટ્રીય પોષણ શપથ લેવામાં આવી હતી સદર કાર્યક્રમમાં ડૉ. એન. આર. પટેલ (વૈજ્ઞાનિક, પશુવિજ્ઞાન), શ્રીમતી એન. વી. શેઠવાલા (પ્રોગ્રામ આસિસ્ટન્ટ), એ હાજર રહી બહેનોને પ્રોત્સાહિત કરી હતી.

